SANBLUE CORPORATION LIMITED

Date: 13/02/2025 BSE Code: 521222

To, BSE Limited Floor 25, P J Towers, Dalal Street, Mumbai-400001.

Dear Sir/Madam

Sub: Intimation of under Regulation Regulation 30 and **47** SEBI (Listing **Obligations** Disclosure Requirements) Regulations, ("SEBI Listing and 2015 Regulations") Newspaper Advertisement related Financial to Unaudited Results of the Company for the quarter and nine months period ended on 31st December, 2024

With reference to the captioned subject, we enclose herewith a copy of newspaper advertisement related to Unaudited Financial Results of the Company for the quarter and nine months period ended on 31 st December, 2024, published in English language newspaper - Westerntime Newspaper and in Vernacular language (Gujarati) newspaper - Westerntime Newspaper

The said newspaper advertisement provides a Quick Response (QR) Code and the weblink of the Company's website to access complete financial results for the said period. The said newspaper clippings are also available on the website of the Company.

We request you to kindly take the same on your record.

For Sanblue Corporation Limited

Jekil Pancholi Company Secretary FCS 12329



Quality Power Electrical Equipments IPO Opens On Friday, February 14, 2025

Susiness

Power IPO The initial public offering (IPO) of critical high voltage equipment manufacturer Quality Power Electrical Equip-Quality

ments Ltd is set to hit Dalal Street this week The mainboard IPO comes comes amid weakness in the secondary

market, with the benchmark indices, Sensex and Nifty 50, having declined significantly from their peaks.

The Indian stock market is witnessing heavy selling pressure from foreign portfolio investors (FPI) amid global geopolitical uncertainties and concerns over domestic economic growth.

Quality Power IPO will

open for public subscription on Friday, February 14, and will close on Tuesday, February 18. The company plans to raise Rs. 858.70 crore from the

size is 26 shares and the minimum investment amount required by retail investors is Rs. 10,426. The IPO allotment is

expected to be finalised on



primary market. Quality Power ÍPO is a book-buiÍt uity shares of Quality Power Electrical Equipments Ltd will be listed on both issue, which comprises a combination of fresh issue of 52.94 lakh equity the stock exchanges, BSE and NSE, likely on Friday, February 21. Pantomath shares aggregating to Rs. 225.00 crore and an offer-Capital Advisors Pvt Ltd is the book-running lead manager of the Quality Power IPO, while Link Infor-sale (OFS) component of 1.49 crore shares worth Rs. 633.70 crore. Quality Power IPO price band has been set at Rs. 401 to Rs. time India Private Ltd is the 425 per share. The IPO lot IPO registrar.

Shanmuga Hospital plans to raise

The company has received approval to launch its public issue on BSE SME Platform. The public issue open for subscription on February 13 and closes on February 17. The Proceeds of the public issue will be used for business expansion including Funding Capital Expenditure towards Purchase of additional Medical Equipment and general corporate purposes. Finshore Management Services Limited is the lead manager of the issue. The initial public offering of Rs. 20.62 crore comprises of a fresh issue of 38.18 lakh equity shares of face value Rs. 10 each at Rs. 54 per share. Out of the

up to Rs. 20.62 crore from IPO
Salem, Tamil Nadu, Salem based Multispecial-ty Hospital, Shanmuga Hospital Ltd is planning to raise up to Rs. 20.62 crore from its SME public issue. The company has received The company has crore. As on 31st March 2024, ROE of the company was at 30.71%, ROCE at 35.89% and RONW at 30.71% with PAT Margin of 12.13% and Debt to Equiand Rs. 3.83 crore towards ty at 0.53 times. general corporate purpose. As on 30th September Minimum lot size for the 2024, Net Worth of the application is 2000 shares company was reported at which translates in to in-Rs. 19.53 crore, Reserves

& Surplus at Rs. 9.73 crore

and Asset base of Rs.

36.53 crore. Shares of the

ational theatres.

kept at 50% of the net of-fer. Promoter holding post company will be listed on BSE SME platform. issue will be 71.95%.
For FY23-24 ended
March 2024, company has
reported net profit of Rs. Intensive Care Unit(NICU), Labour Room, Endoscopy Room, Neurosurgery Unit, and Cardiac Unit. The Diagnostic Cen-5.26 crore and revenue of Rs. 43.39 crore with a tre features advanced labhealthy EBITA margin of oratory and imaging tech-19.77% and PAT margin of nologies such as X-Ray, 12.13%. For the six months Ultrasound, Computed Toended September 2024, mography (CT) scan, Magnetic Resonance Imaging company reported total revenue of Rs. 24.82 crore (MRI), and modular oper-

I have changed my old name

from HARSH DIPAK SHAH to new name HARSH DIPAKKUMAR SHAH Add. N-23, Asmaakam Phase-2, Makarba, Ahmedabad

CHANGE OF NAME

CHANGE OF NAME

have changed my old name from MAHESHBHAI NATVARBHAI PATEL to new name MAHESHKUMAR NATVARLAL PATEL Add. 12-A, Monarch City-2, At/Shela, Ahmedabad-380058

CHANGE OF NAME

have changed my old name from PARESHKUMAR JETHANAND MADNANI to new name PARESH JETHANAND MADNANI Add. 179/A, Sindhi Colony, Sardarnagar Ahmedabad-382475

5183

5180

CHANGE OF NAME

I have changed my old name from **JIGARKUMAR RASIKLAL SHAH** to new name JIGAR RASIKBHAI SHAH Add. Satva-5, Near Yash Platina, Ahmedabad-382330

CHANGE OF NAME

I have changed my old name from AJESHKUMAR
KANTILAL KOTAK to new name AJAYKUMAR KANTILAL KOTAK Add. F/6, Ashapuri Society, Maninagar Ghodasar,

Ahmedabad

5179

CHANGE OF NAME

have changed my old name from **DIPALIBEN RAVISH** HIRPARA to new name DIPALI CHIRAG MODI

Add. B-6, Ratnaakar Verte, Near Sobo Center, South Bopal,

Ahmedabad-380058 5181B

- : જાહેર નિવિદા : -

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબના કામો માટે રસ ધરાવતા કોન્ટ્રાક્ટરો/એજન્સી/પેઢી પાસેથી nprocure/GEM પોર્ટલ પર ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ દરેક કામની વિગતવાર માહિતી તથા ટેન્ડર શરતો અમારી વેબસાઈટ www.bmcgujarat.com પર જોઈ શકાશે.

કામનું નામ, કિંમત અને ટેન્ડર ભરવાની તારીખ ભાવનગર મહાનગરપાલિકાની હદમાં અધેવાડા ટી.પી. સ્કીમ નં.-૭ ફાઈનલ પ્લોટ નં. ૬ દમાં ડ્રેનેજ વિભાગનાં સ્ટોરનું બાંધકામ કરવાનું કામ (nprocure પર) કિંમત :- ૨,૮૩,૩૩,૦૫૯/-, ટેન્ડર ભરવાની તારીખઃ- ૧૩/૦૨/૨૦૨૫થી ૦૫/૦૩/૨૦૨૫

> જનસંપર્ક અધિકારી ભાવનગર મહાનગરપાલિકા

> > ભાવનગર

DDI/BVN/1056/25

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

VARIOUS ENGINEERING WORKS

١		E- Tender Notice No	. 31	Of 2024-25 Dated: 11	.02.2025			
	Sr. No.			Approximate NIT Cost	EMD Cost			
				2,33,06,480.15	2,66,500.00			
	1	Improvement to drainage arr surface of LHS Under Jurisdict						
		DRM-ADI-206-2024-25		2,33,21,394.06	2,66,600.00			
	2	Improvement to drainage arr						
		surface of LHS Under Ju	Divisional Engine					
	Dhrangadhra.							
	DRM-ADI-207-2024-25			28,73,92,571.45	15,87,000.00			
١		Samakhiali- Gandhidham sa	ction	- Providing cattle fenci	ng in connection w			

CRO prone locations. Closing date & time of e-tender: Date 04/03/2025 Time 15:00 hrs Office Address: Senior Divisional Engineer (cord) Ahmedabad, D.R.M. Office, Near Chamunda Bridge, Opposite New Swadeshi Mill, Naroda Road, Amdupura, Ahmedabad- 382345 Website for participating e-tender

CHANGE OF NAME

I have changed my old name from PATEL

SABBIRHUSAIN ALIBHAI to new name SHABBIR ALIBHAI PATEL

Add. GF-1, Gajnavi House, Nanichalis Gharani

Pole, Kanchni Masjid, Jamalpur,

Ahmedabad-380001

CHANGE OF NAME I have changed my old name from RAMILABAHEN ARVINDKUMAR MODI to new name RAMILABEN ARVINDKUMAR MODI Add. B-6. Ratnaakar Verte. Near Sobo Center. South Bopal. Ahmedabad-380058

CHANGE OF NAME have changed my old name from AJMERWALA MOHD.SALMAAN AHMEDHUSSAIN to new name AJMERWAWLA MOHAMMEDSALMAAN AHMEDHUSSAIN Add. 3880, Savayjini Gali, Nadiyawad, Jamalpur,

Ahmedabad-380001

PUBLIC NOTICE

We Would like to inform Everyone Associated or Affected by our Company that we have Change our Company Old Name

From "SILVER SINE BIO TEC"

ADD.: 246/5, Uma Estate, K.T. Campus,B/H Bhagyoday Hotel, Sanand, Viramgam Road, Vasna (Iyava), Sanand, Dist. Ahmedabad-382170 dated 09/01/2025 to

Company New Name

"SILVER SINE BIO TECH"

ADD.: 246/5, Uma Estate K.T.Campus,B/H Bhagyoday Hotel Sanand- Viramgam Road,Vasna (Iyava), Sanand, Dist. Ahmedabad-382170

5181

4999

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

E-AUCTION FOR THE CONTRACT OF CATERING SERVICES With reference to above, e-Auction for the contract of catering services at catering nits over Ahmedabad Division has been invited. The catalogue has already been oublished on IREPS website. The details are furnished as under :-

	Catalogue No.	Category	Date & Time of E-Auction					
	CTG-ADI - 04 - 24	Catering	E-Auction for all Lots will start at 11:15 hours on 26.02.2025					
Note : Prospective Bidders are requested to visit e-Auction Leasing module								

IREPS website (www.ireps.gov.in). The Lot-wise details are available therein under the above - mentioned Catalogue No. Initial Cooling Off period is 30 minutes. Successive Lot Closing interval is 10 minutes. Lot-wise Closing Time can be viewed e-Auction module of IREPS.

PROMACT IMPEX LIMITED

[CIN: L25200GJ1985PLC007746] Reg.Office:12th Floor-1201, City Center-2, B/s. Heer Party Plot, Nr.Shukan Mall Cross Road, Science City Road, Sola, Ahmedabad - 380060

UNAUDITED STANDALONE FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2024 The Board of Directors in their meeting held on 12th February 2025, have approved and taken on record the Unaudited Financial Results for the quarter ended on 31st December, 2024 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.

The aforesaid Unaudited Financial Results for the quarte ended 31st December, 2024 along with Limited Review Report thereon are available on website of BSE Limited at www.bseindia.com and also on Company website and can also be accessed by scanning below Quick Response Code:



For Promact Impex Limited ANKIT J. PATEL MANAGING DIRECTOR (DIN:02351167) Date: 12th February, 2025

RBI to inject Rs 2.5 lakh crore enhance li

and Net Profit of Rs. 2.39

vestment of Rs. 1.08 lakh

per application. Retail in-

vestor quota for the IPO is

in banking system

Mumbai, Feb 12 (IANS) The Reserve Bank of India (RBI) was all set to inject Rs 2,50,000 crore through its Variable Rate Repo (VRR) auction on Wednesday to enhance liquidity in the banking system. The Central Bank has stated that the amount has been decided based on an assessment of the liquidity conditions. The Reserve Bank also said it will be conducting daily Variable Rate Repo (VRR) auctions on all working days in Mumbai with reversal taking place on the next working day, until further notice.

CHANGE OF NAME

have changed my old name from SHAIKH **MOHMEDAZHAR** JAFARBHAI to new name SHAIKH MOHAMMEDAZHAR ZAFARBHAI

Add. 3, Vinaykunj Society, Danilimda Ahmedabad-380028 5181C

SANBLUE CORPORATION LTD.

Reg. off: 22-A, Government Servant Soc., Nr Muncipal Market, C.G. Road, Ahmedabad-380009. Email: inquiry@sanbluecorporation.com • Website: www.sanbluecorporation.com

Extract of Financial Results for the nine month ended & Quarter ended on 31st December, 2024

	(Rs. in Lacs, except per share data									
Sr. No.		Qua	arter Ende	d	Nine Mo	Previous Year Ended				
INU.			Unaudited		Unau	Audited				
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024			
1	Total income	25.02	43.80	23.47	70.63	62.05	204.52			
2	Net profit/(loss) for the period/year (before tax, exceptional and/or Extraordinary Items)	11.47	35.77	14.62	41.91	37.76	34.63			
3	Net profit/(loss) for the period/year (before tax, after exceptional and/or Extraordinary Items)	11.47	35.77	14.62	41.91	37.76	34.63			
4	Net profit/(loss) for the period/year (after tax, after exceptional and/or Extraordinary Items)	16.05	24.19	10.57	34.91	27.70	25.33			
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	648.22	(298.55)	1106.34	1185.92	2411.16	1567.61			
6	Paid Up Equity Share Capital	499.96	499.96	499.96	499.96	499.96	499.96			
7	Other Equity	-	-	-	-	-	5146.28			
8	Security Premium Account	-	-	-	-	-	-			
9	Basis & Diluted	0.32	0.48	0.21	0.70	0.55	0.51			

Note: The full Format of the quarterly Financial Results is available on the website of the Company and Bombay Stock Exchange at https://www.sanbluecorporation.com/financial-results.html & https://www.bseindia.com/stock-share-price/sanbluecorporation-Itd/sanblue/521222/ respectively, and the said financial results can also be accessed by scanning a Quick Response (QR) Code given below

Place: Ahmedabad Date: 12th February, 2025

For and on behalf of the Board of Directors **Sanblue Corporation Limited** Jekil Pancholi - Company Secretary - FCS: 12329

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED

CIN: L55100GJ1991PLC015839

Regd. Office: International Airport Circle, Ahmedabad 382475, Web: www.rmhil.com email: royalemanorehotels@rediffmail.com, Telephone: 079-22868642/43

Extract of Unaudited Financial Results for the Quarter &

Nine Months Ended 31st December, 2024

(Rs in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended 31/12/2024	Year Ended 31/03/2024	Quarter Ended 31/12/2023
		(Unaudited)	(Audited)	(Unaudited)
1	Total Income from operations (Net)	639.37	2512.45	761.97
2	Net Profit/(Loss) for the period (Before			
	Exceptional Items & Tax)	90.71	560.74	278.56
3	Net Profit / (Loss) for the period before tax	90.71	560.74	278.56
4	Net Profit / (Loss) for the period after tax	66.12	421.79	209.71
5	Total Comprehensive Income for the period	66.12	422.13	209.71
6	Paid up Equity Share Capital	1983.22	1983.22	1888.22
7	Reserves (Excluding Revaluation Reserve as	3840.71	3840.71	3301.63
	shown in the Balance Sheet of previous year)	(as on	(as on	(as on
		31.03.2024)	31.03.2024)	31.03.2023)
8	Earnings Per Share (Rs. 10/-each)			
	Basic (Rs.)	0.33	2.21	1.11
	Diluted (Rs.)	0.33	2.21	1.11

NOTES: -

The above results were reviewed by the Audit Committee & thereafter approved by the Board of Directors at its meeting held on February 12, 2025.

Previous year's/quarter's figures have been regrouped and/or rearranged, wherever

considered necessary.

The above is an extract of the detailed format of Quarterly & Nine Months Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website www.rmhil.com

By Order of the Board For Royale Manor Hotels and Industries Limited VISHWAJEETSINGH U. CHAMPAWAT

Chairman & Managing Director

Place: Ahmedabad Date : February 12, 2025

DIN: 00519755

CONSOLIDATED

PUBLIC NOTICE

FORM NO. URC-2

FORM NO. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Companies Act, 2013

[Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014|

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar at Central Registration Centre (CRC) that M/s. Bladesmith Industries, a registered Partnership Firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013. as a company under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company

2. The principal objects of the company are as follows:

To carry on the business of buy, sale, wholesale, retail sale, Export & import, manufacturing of Railing, Balustrades, Furniture Fabrication, in Stainless steel, Aluminum, Wooden, Acrylic, metal furniture, rack and Steel Cupboard, Fittings of metal for furniture, furniture casters of metal, fittings of metal for furniture, door frames of metal, door fittings or metal, chimneys of metal, building or furniture fittings of nickel silver and cast steel, railings of metal, pillars of metal.

A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at 171, SAHITYA IND HUB, BAKROL BUJRANG, AHMEDABAD-382340 GUJARAT,

3. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana) Pin Code - 122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office 171 SAHITYA IND HUB, BAKROL BUJRANG, AHMEDABAD-382340 GUJARAT, INDIA.

Dated this12th day ofFebruary, 2025.

Name(s) of Applicant

1.Sunilkumar Narsinhbhai Panchal 2. Ashishkumar Narshibhai Panchal

GUJARAT LEASE FINANCING LIMITED (CIN: L65990GJ1983PLC006345)

By Order of the Board

Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge, Ahmedabad-380 006. Ph: 079-26575722, E-mail: glflho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024

(₹ in Lacs except per share data)

SI.	Particulars	Quarter Ended	Nine Months Ended	Quarter Ended 31.12.2023	
No.		31.12.2024	31.12.2024		
		(Un-audited)	(Un-audited)	(Un-audited)	
1	Total Income	10.94	31.71	17.47	
2	Total Expenses	5.92	30.40	5.65	
3	Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items	5.02	1.31	11.82	
4	Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items	5.02	1.31	11.82	
5	Total Comprehensive Income for the period (after tax)	5.62	4.14	12.88	
6	Equity Share Capital	2712.58	2712.58	2712.58	
7	Reserves excluding Revaluation Reserve as per Balance Sheet	-	-	-	
8	Earning Per Share (of ₹ 10/- each) Basic and Diluted	0.02	0.00	0.04	

Note: The above is an extract of the detailed financial results for the quarter and nine months ended December 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes, is available on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website. (URL: https://www.gujaratleasefinancing.co.in/newfin_menu_2425Q3.htm) The same can be accessed by

scanning the QR code provided below.

Date: February 12, 2025 Place: Ahmedabad

STANDALONE

AMRAPALI INDUSTRIES LIMITED

Regd. Office: - Unit No. PO5-02D, 5th Floor Tower A WTC Gift City Gandhinagar-382355. CIN :L91110GJ1988PLC010674 Phone: +7926581329/30 Fax: +91 79 26579169 E-mail: ail@amrapali.com Website: www.amrapalispot.com.

> STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE **QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2024**

(Rs. in Lakh)

	STANDALONE						CONSOLIDATED					
PARTICULARS	Quarter Ended		Nine Months Ended Year ende		Year ended	Quarter Ended			Nine Months Ended		Year ended	
	31/12/2024	30/09/2024	31/12/2023	31/12/2024	31/12/2023	31/03/2024	31/12/2024	30/09/2024	31/12/2023	31/12/2024	31/12/2023	31/03/2024
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total Income from Operations	11,47,305.49	8,03,128.36	8,46,144.97	22,42,465.80	22,15,755.17	27,30,089.22	11,47,305.49	8,03,128.36	8,46,144.97	22,42,465.80	22,15,755.17	27,30,089.22
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	26.41	24.59	21.12	79.32	66.36	103.07	26.57	24.30	21.12	79.47	66.36	103.07
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	26.41	24.59	21.12	79.32	66.36	103.07	26.57	24.30	21.12	79.47	66.36	103.07
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	27.49	10.43	16.30	63.87	64.86	89.66	27.65	10.14	16.30	64.02	64.86	89.66
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	27.49	10.43	16.30	63.87	64.86	89.66	27.65	10.14	16.30	64.02	64.86	89.66
Equity Share Capital	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year												
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic & Diluted:	0.05	0.02	0.03	0.12	0.13	0.17	0.05	0.02	0.03	0.12	0.13	0.17

Place: AHMEDABAD

Date: 12/02/2025

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com and on company's website www.amrapalispot.com.

For AMRAPALI INDUSTRIES LIMITED

YASHWANT AMRATLAL THAKKAR MANAGING DIRECTOR DIN:00071126



ઈએસઆઈસીના પેન્શન એસોસીએશન દ્વારા નિવૃત્ત કર્મચારી ભરતભાઈ દેસાઈનું શાલઓટાડીને સન્માન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઈએસઑઈસીના ડાયરેક્ટર(ગુજરાતે)ભરતભાઈની કામગીરીઓને બિરદાવી હતી.

આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળતા સુશ્રી દેવાહુતી

(પ્રતિનિધિ) આણંદ, આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાની બદલી આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે થતા તેમની જગ્યાએ આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ષ ૨૦૨૦ ની બેચના આઈ.એ.એસ. અધિકારી સુશ્રી દેવાહુતીની બદલીથી નિમણૂક થતાં તેમણે આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યો છે.

જમ્મુ કાશ્મીરના વતની એવા દેવાહુતી બી.એ, ર્બેલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સનદી સેવા માટેની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૨૦ માં આઈ.એ.એસ. આઈ.એ.એસ. બન્યા બાદ તેમણે પ્રોબેશન સમયમાં ખેડા જિલ્લામાં અને ત્યારબાદ આસિસ્ટન્ટ કલેકટર, ગોંડલ અને રાજકોટ ગ્રામ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યા પહેલા તેઓ બનાસકાંઠા

જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર

તરીકે ફરજ બજાવતા હતા.



જિલ્લાઓની તેમની ફરજ દરમિયાન ગુજરાતના લોકોના સહકારભર્યા સ્વભાવને બિરદાવી તેમણે આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની તેમની પ્રાથમિકતા જણાવતા ઉમેર્યું હતુ કે, આણંદ જિલ્લો વિકાસશીલ જિલ્લો છે. આ જિલ્લાના વિકાસને આગળ વધારવાની મને જે તક મળી છે તેને હું નિષ્ઠાપૂર્વક અદા કરી આણંદ જિલ્લાના વિકાસને વેગ મળે તે માટે હંમેશા પ્રયત્નશિલ રહીશ.

ગોધરાના પીપળીયાધરી ગામે કાર ચાલકે સાચકલ સવારને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ

(પ્રતિનિધિ) ગોધરા.

ગોધરા તાલુકાના પીપળીયાધરી ગામે કારચાલકે સાયકલસવારને અડફેટે લઇને ઈજાઓ પહોંચાડી હતી, સમગ્ર મામલે કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંધરા તાલુકાના પીપળીયાધરી ગામે રહેતા મફતભાઈ ધૂળાભાઈ પરમાર ગત તાં ૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે ગોધરા તાલુકાના પીપળીયાધરી ગામે આવેલ ધરી ચોકડી પાસેના રોડ પરથી પોતાની સાયકલ લઈને આવી રહ્યા હતા, તે વેળાએ સામેથી પૂરઝડપે આવેલા ઈકો કારના ચાલકે સાયકલસવાર મફતભાઈ પરમારને અડફેટે લીધા હતા, આ અકસ્માતમાં મફતભાઈ ફંગોળાઈને રોડ પર પડતા જમણા પગના ભાગે, ડાબા હાથે તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ ઈકો કારનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.

એસઆઈજીએ ભારતમાં તેનો પ્રથમ

એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો

અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી (SIG) એ ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના

ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરે છે. અમદાવાદમાં માત્ર

૨૦ મહિનામાં પૂર્ણ થયેલ આ €0 મિલિયનનું રોકાણ,

એસઆઈજી (SIG)માટે એક મુખ્ય સીમાચિદ્ધરૂપ છે

કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડેપથી

વિકસતા બજારોમાંની એકમાં તેની હાજરીને મજબૂત

બનાવે છે. એસઆઈજીના સીઈઓ સેમ્યુઅલ સિગ્રિસ્ટે

જણાવ્યું હતું કે, 'આ નવો પેકેજિંગ પ્લાન્ટ ભારત પ્રત્યેની

અમારી પ્રતિબદ્ધતા અને તેની અવિશ્વસનીય વૃદ્ધિની

સંભાવનાનો પુરાવો છે.' "અમને અમારા ભારતીય

ભાગીદારોને ઉચ્ચ-ગુણવત્તાવાળા પેકેજિંગ સોલ્યુશન્સ અને ઝડપી, લવચીક ફિલિંગ ટેક્નોલોજી સાર્થે ટેકો

આપવા માટે ગર્વ છે. આ વાઇબ્રન્ટ માર્કેટમાં અમારી

મજબૂત ભાગીદારી અમારી સતત સફળતાનો પાયો

છે."ેએસઆઈજી ખાતે માર્કેટ ઈન્ડિયા અને

બાંગ્લાદેશના હેડ વંદના ટંડને ઉમેર્યુંઃ "ભારત વિશ્વના

સૌથી નિર્ણાયક ડેરી બજારોમાંનું એક છે, અને વર્ષોથી, પીણા પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

છે. આ અમારા માટે ગ્રાહકોની વિકસર્તી જરૂરિયાતોને

પહોંચી વળવા માટે નવીન અને ટકાઉ એસેપ્ટિક પેકેજો

સાથે ગ્રાહકોને પૂરી કરવાની અતુલ્ય તક રજૂ કરે છે.

અમે દેશ અને પડોશી પ્રદેશોમાં અમારી પહોંચ વધારવા

આતુર છીએ.'' અત્યાધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન

કરાયેલ, ગુજરાત રાજ્યમાં પ્લાન્ટની પ્રારંભિક વાર્ષિક

ઉત્પાદન ક્ષમતા ૪ બિલિયન એસેપ્ટિક કાર્ટન પેક સુધી

છે, જે ૩૦૦ થી વધુ સ્થાનિક નોકરીઓનું સર્જન કરતી

વખતે ઉચ્ચ પર્યાવરણીય ધોરણોને પૂર્ણ કરે છે. આ પ્લાન્ટ એસઆઈજી (જીંંય)ના વધર્તો ફિલર બેઝને

સ્વિટ્ઝર્લેન્ડના ન્યુહૌસેનમાં હેડક્વાર્ટર ધરાવતાં

સેવાલીયા શ્રી.સી.પી.પટેલ હાઇસ્કૂલમાં ફરજ બજાવતા 'ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ' જે.જે.પટેલનો વચનિવૃત્તિ સમારંભ ચોજાયો

(प्रतिनिधि) सेवालीया, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની નામાંકિત શ્રેયસ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સી.પી.પટેલ હાઇસ્કૂલમાં છેલ્લા ૩૧ વર્ષ થી ફરજ બજાવતા અને છેલ્લે ''ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ'' पदेथी उ१/०५/२०२५ ना रोक्ष वयनिवृत्त थतां श्री के.के.पटेबनो સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રેયસ એજ્યુર્કેશન સોસાયટીના પ્રમુખ ડી.સી.પટેલ, મંત્રી શ્રી બી.સી.પટેલ અને આણંદથી ખાસ

પધારેલ શ્રી અમિતભાઈ ત્રિવેદી તથા શાળા પરિવારના એવા વસોના વતની દાતા શ્રીમતી માધુરી બેન પટેલ તથા શ્રી કમલેશભાઇ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી જે.એ.મહિડા, પ્રફીતા બેન, શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ તથા શાળાના વિધ્યાર્થીઓ તથા શ્રી જે.જે.પટેલના સગા-વ્હાલા, ગ્રામજનો તથા ગળતેશ્વર તાલુકાની શાળા ઓના આચાર્યશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા

જેમાં ઉપસ્થિત શ્રી ડી.સી.પટેલ તથા શાળાના આચાર્ય શ્રી જે.એ.મુહિડા તથા શાળાના વિધ્યાર્થીઓએ શ્રી જે.જે.પટેલની કામગીરીને બિરદાવી ને તેઓનું બાકીનું જીવન સદૈવ તંદુરસ્ત, દીર્ઘાયું અને સુખ-સમૃદ્ધિમય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.તો શ્રી જે.જે.પટેલે પણ પોતાની ફરજ દરમિયાન સાથ અને સહકાર

નામ બદલેલ છે

મેં મારું નામ **અજેશકુમાર** કાન્લીલાલ કોટક હતું, જે **ાદલીને અજચકુમાર કા**ન્તીલાલ **કોટક** કરેલ છે. સરનામું : એફ-૬, આશાપુરી સોસા, મણીનગર ઘોડાસર, અમદાવાદ

PUBLIC NOTICE

We Would like to inform Everyone Associated or Affected by our Company that we have Change our Company Old Name From "SILVER SINE BIO TEC" ADD.: 246/5, Uma Estate K.T. Campus,B/H Bhagyoday Hotel, Sanand, Viramgam Road Vasna (Iyava), Sanand, Dist. Ahmedabad-382170 dated 09/01/2025 to Company New Name
"SILVER SINE BIO TECH" ADD.: 246/5, Uma Estate, C.T.Campus,B/H Bhagyoday Hote Sanand- Viramgam Road, Vasna (Iyava), Sanand,



આપનાર તમામનો આભાર માન્યો હતો, અને સૌને (શાળાના ૯૦૦ જેટલા બાળકો સહિત) ભોજન કરીને જવા વિનંતી કરી હતી. જેમાં શાળાના કર્મચારીઓ વિધાર્થીઓ તથા આમંત્રિત ગ્રામજનો અને મહેમાનો સહિત વ્યક્તિઓનો ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો.

તો આજના પ્રસંગે શાળા પરિવારના એવા વસોના વતની દાતાશ્રી શ્રીમતી માધુરીબેન પટેલ તથા શ્રી કમલેશભાઇ પટેલ તરફથી શાળાના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી ક્લીપબોર્ડ આપવામાં આવ્યા હતા. અંતમાં આભાર વિધિ શ્રી આર.ડી.ભોઇ કરી હતી તથા આચાર્ય

કાર્યક્રમનું સમગ્ર સફળ સંચાલન શાળાના જે.એ.મહિડાના માર્ગદર્શન હેઠળ શ્રી બી.એસ.પ્રજાપતિએ કર્યું હતું.

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

કેટરિંગ સર્વિસ કોન્ટ્રાક્ટ માટે ઈ-ઓક્શન નીચેના કેટલોગ માટે અમદાવાદ ડિવિઝનમાં કેટરિંગ એકમોમાં કેટરિંગ સેવાઓના કોન્ટાક્ટ માટે નીચેની સૂચિ માટે ઇ-ઓક્શન પર બિડ આમંત્રિત કરવામાં આવે છે, જે IREPS વેબસાઇટ પર પહેલેથી જ

ૂ પ્રકાશિત કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ રજૂ ક કેટલોગ નં. CTG-ADI - 04 - 24 કેટરિંગ

નોંધ: સંભવિત બોલી લગાવનારાઓને IREPS વેળ

લીઝિંગ મોડ્યલની મલાકાત લેવા વિનંતી છે. લોટ ઉપલબ્ધ છે. પ્રારંભિક કૂલિંગ ઓફ પિરિયડ 30 મિનિટનો છે. ક્રમિક લોટ બંધ થવાનો અંતરાલ 10 મિનિટનો છે. લોટ મુજબ બંધ થવાનો સમય IREPS ના ઈ-ઓક્શન મોડ્યુલમાં જોઈ શકાય છે. 🛾 😘

અમને લાઇક કરો : 🚹 facebook.com/WesternRly ∙ અમને ફ્રોલો કરો : 🔀 twi<u>tter.com/WesternRly</u>

PROMACT IMPEX LIMITED

[CIN: L25200GJ1985PLC007746] Reg.Office:12th Floor-1201, City Center-2, B/s. Heer Party Plot, Nr.Shukan Mall Cross Road, Science City Road, Sola, Ahmedabad - 380060

UNAUDITED STANDALONE FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2024 The Board of Directors in their meeting held on 12th February Financial Results for the quarter ended on 31st December 2024 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.

The aforesaid Unaudited Financial Results for the quarter ended 31st December, 2024 along with Limited Review Report thereon are available on website of BSE Limited at www.bseindia.com and also on Company website and car also be accessed by scanning below Quick Response Code



Date: 12th February, 2025 Place: Ahmedabad

By Order of the Board For Promact Impex Limited ANKIT J. PATEL MANAGING DIRECTOR (DIN:02351167)

વડતાલમાં સ.ગુ.ગોપાળાનંદ સ્વામીનો ર૪૪મો પ્રાગટ્યદિન ધામધૂમથી ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના

તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં સંતોની ધર્મશાળામાં આવેલ અ. મૂર્તિ.સ.ગુ.શ્રી ગોપાળાનંદસ્વામીના આંસને બુધવારના રોજ તેઓના ૨૪૪માં प्रागट्य हिन निभित्तो भाववंहना કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃંદાબેન નીલેશભાઇ ઠક્કર તથા તારાપરના પ.ભ.ગોવિંદભાઇ ચુનીભાઇ ઠક્કર પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી અંતર્ગત સાંજે સંતોને જમાડવા સંત રસોઇ પણ આપવામાં આવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંત વલ્લભદાસજીએ અ.મૂ. સ.ગુ.શ્રી ગોપાળાનંદસ્વામીના ૨૪૪મા પ્રાગટ્યદિનની માહિતી આપના

લેસ્ટર્ને ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

(પ્રતિ**નિધિ) આણંદ,** જણાવ્યું હતું કે યોગીરાજ ગોપાળાનંદ[ે] સ્વામીના આસને પૂ.મોટા લાલજી સ્વામી એક સિદ્ધ પુરૂષ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીને દેવ પ્રકાશ રવામી, લક્ષ્મી

સૌરભ પ્રસાદદાસજી, ચેરમેન અક્ષરમૂર્તિ તરીકે લેખવામાં આવ્યા છે નારાયણસ્વામીના હસ્તે હરિયાગનો બુધવારે સવારે સ.ગુ.શ્રી ગોપાળાનંદ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

(શેર દીઠ માહિતી સિવાય, રૂ. લાખમાં)

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative

Venue Hotel Comfv. 1st Floor, Radhe Kishan Arcade. Opposite Ghodasar Brts, Isanpur, Ahmedabad Date: 15th February, 2025 Time: 6:00 p.m.

Contact Person: Pravin Sumesara (9898018526)

Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow We look forward to your participation.



Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully

सानक्त्यू डोपेरिशन सिभिटेड

CIN: L15400GJ1993PLC020073 રજી. ઓફ્સિ: ૨૨ - એ, ગવર્મેન્ટ સર્વન્ટ સોસાચટી, મ્યુનિસિપલ માર્કેટ પાસે, સી.જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ Email: inquiry@sanbluecorporation.com • Website: www.sanbluecorporation.com ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પૂર્ણ થયેલાં નવ માસિક અને ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોનો સારાંશ

ત્રિમાસિક ગાળા નવ માસિક ગાળા ઓડિટેડ અનઓડીટેડ અનઓડીટેડ 39.92.2028 30.06.2028 39.92.2023 39.92.2028 39.92.2023 39.03.2028 ૧ કુલ આવક 83.60 60.93 ચોખ્ખો નફો/(નુકસાન) સમચગાળા/વર્ષ માટે 99.86 34.66 ४१.५१ 30.69 (કર પહેલા, અપવાદરૂપ અને / અથવા અસાધારણ વસ્તુઓ ચોખ્ખો નફો/(નુકસાન) સમયગાળા/વર્ષ માટે 99.86 34.66 ૧૪.૬૨ ४१.५१ 36.69 38.93 (કર પહેલા, અપવાદરૂપઅને / અથવા અસાધારણ વસ્તુઓ) ૨૫.૩૩ ચોખ્ખો નફો/(નુકસાન) સમયગાળા/વર્ષ માટે ૧૦.૫७ 99.04 ₹8.96 38.69 20.00 (કર પછી, અપવાદરૂપઅને / અથવા અસાધારણ વસ્તુઓ)

કુલ વ્યાપક આવક સમયગાળા માટે ૧૫૬७.૬૧ (૨૯૮.૫૫) **૧૧**૦૬.3૪ ૧૧૮૫.૯૨ ૨૪૧૧.૧૬ _ (નફો/(નુકસાન) નો સમાવેશ સમયગાળા માટે મને અન્ય વ્યાપક આવક (કર પછી) ચૂકવેલ ઈક્વીટી શેર કેપીટલ 866.68 866.69 866.69 866.68 866.69 866.69 અન્ય ઈક્વીટી ૫૧૪૬.૨૮ સીક્ચોરીટી પ્રીમીચમ એકાઉન્ટ 9.39 0.86 0. ૨૧ 0.60 0.44 ૯ બેઝિક અને ડાઈલ્યુટેડ

નૉંઘ- (અ) ઉપરોક્ત ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ કંપની વેબસાઇટ https://www.sanbluecorporation.com/financial results.html અને બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ https://www.bseindia.com/stock-share-price/sanblue-corporationltd/sanblue/521222/ પર ઉપલબ્ધ છે. અને અહિં આપેલ ક્વિક રિસ્પોન્સ (QR) કોડને સ્કેન કરીને ઉપરોક્ત નાણાકીય પરિણામો પણ એક્સેસ કરી શકાય છે

સ્થળ : અમદાવાદ તારીખ : ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫



બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અને વતી, સાનબ્લ્યુ કોર્પોરેશન લિમિટેડ

જેક્લિ પંચોલી - કંપની સેક્રેટરી - FCS: 12329

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED

CIN: L55100GJ1991PLC015839

Regd. Office: International Airport Circle, Ahmedabad 382475, Web: www.rmhil.com email: royalemanorehotels@rediffmail.com, Telephone: 079-22868642/43

Extract of Unaudited Financial Results for the Quarter & Nine Months Ended 31st December, 2024

			(It's III Eakils)	
Sr. No.	Particulars	Quarter Ended 31/12/2024 (Unaudited)	Year Ended 31/03/2024 (Audited)	Quarter Ended 31/12/2023 (Unaudited)
1	Total Income from operations (Net)	639.37	2512.45	761.97
2	Net Profit/(Loss) for the period (Before Exceptional Items & Tax)	90.71	560.74	278.56
3	Net Profit / (Loss) for the period before tax	90.71	560.74	278.56
4	Net Profit / (Loss) for the period after tax	66.12	421.79	209.71
5	Total Comprehensive Income for the period	66.12	422.13	209.71
6	Paid up Equity Share Capital	1983.22	1983.22	1888.22
7	Reserves (Excluding Revaluation Reserve as	3840.71	3840.71	3301.63
	shown in the Balance Sheet of previous year)	(as on 31.03.2024)	(as on 31.03.2024)	(as on 31.03.2023)
8	Earnings Per Share (Rs. 10/-each)			
	Basic (Rs.)	0.33	2.21	1.11
	Diluted (Rs.)	0.33	2.21	1.11

NOTES:-

Place: Ahmedabad

February 12, 2025

Date:

The above results were reviewed by the Audit Committee & thereafter approved by the Board of Directors at its meeting held on February 12, 2025.

Previous year's/quarter's figures have been regrouped and/or rearranged, wherever

The above is an extract of the detailed format of Quarterly & Nine Months Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website www.rmhil.com

By Order of the Board For Royale Manor Hotels and Industries Limited VISHWAJEETSINGH U. CHAMPAWAT

Chairman & Managing Director DIN: 00519755

0.05

0.02

GUJARAT LEASE FINANCING LIMITED

(CIN: L65990GJ1983PLC006345)

Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge, Ahmedabad-380 006. Ph: 079-26575722, E-mail: glflho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024

Quarter Nine Months Quarter **Particulars** Ended Ended Ended No. 31.12.2024 31.12.2023 31.12.2024 (Un-audited) (Un-audited) (Un-audited) 1 Total Income 10.94 31.71 17.47 2 Total Expenses 5.92 30.40 5.65 Net Profit/(Loss) for the period before 1.31 11.82 5.02 Tax and Extraordinary items Net Profit/(Loss) for the period after 11.82 5.02 1.31 Tax and Extraordinary items Total Comprehensive Income for the 5.62 4.14 12.88 period (after tax) 6 Equity Share Capital 2712.58 2712.58 2712.58 Reserves excluding Revaluation Reserve as per Earning Per Share (of ₹ 10/- each) 0.02 0.00 0.04 Basic and Diluted

Note: The above is an extract of the detailed financial results for the quarter and nine months ended December 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes, is available on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website. (URL: https://www.gujaratleasefinancing.co.in/newfin_menu_2425Q3.htm) The same can be accessed by

scanning the QR code provided below Date: February 12, 2025

CONSOLIDATED

PUBLIC NOTICE

ફોર્મ નંબર ચુઆરસી-૨

પ્રકરણ XXI ના ભાગ I હેઠળ નોંધણી વિશે સૂચના આપતી જાહેરાત (કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૩૭૪(b) અને કંપનીઓના નિયમ ૪(૧) (નોંધણી માટે અધિકૃત) અનુસાર નિયમો, ૨૦૧૪)

૧. આથી સૂચના આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૩૬૬ ની પેટા-કલમ (૨) ના અનુસંધાનમાં, અહીંથી પંદર દિવસ પછી અરજી કરવાની દરખાસ્ત કરવામાં આવે છે પરંતુ અમદાવાદ ખાતે રજિસ્ટ્રારને ત્રીસ દિવસની મુદત પૂરી થાય તે પહેલાં. કે **બ્લેડસ્મિથ** ઇન્ડસ્ટ્રીસ એ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ કંપની એક્ટ ૨૦૧૩ના પ્રકરણ XXIના ભાગ lે હેઠળ શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે રજીસ્ટર થઈ શકે છે.

૨. કંપનીના મુખ્ય હેતુઓ નીચે મુજબ છેઃ

સપ્લાય કરશે,

સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, લાકડાના, એક્રેલિક, મેટલ ફર્નિચર, રેક અને સ્ટીલ કબાટ, ફર્નિચર માટે ધાતુના ફિટિંગ, મેટલના ફર્નિચર કાસ્ટર, ફર્નિચર માટે ધાતુના ફિટિંગ, મેટલના દરવાજાના ફ્રેમ, દરવાજાના ફિટિંગ અથવા મેટલ, મેટલની ચીમની, નિકલ સિલ્વર અને કાસ્ટ સ્ટીલના મકાન અથવા ફર્નિચર ફિટિંગ, મેટલની રેલિંગ, મેટલના થાંભલા, મેટલના ખરીદી, વેચાણ, જથ્થાબંધ, છૂટક વેચાણ, નિકાસ અને આયાત, રેલિંગનું ઉત્પાદન, બાલસ્ટ્રેડ, ફર્નિચર

પ્રસ્તાવિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને એસોસિએશનના લેખોની એક નકલ ૧૭૧, સહાય્ય ઇન્ડ હબ, બકરોલ બુજરંગ, અમદાવાદ-૩૮૨૩૪૦ ગુજરાત, ભારત ખાતેની ઓફિસમાં તપાસી શકાય છે.

૩. આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ આ નોટિસના પ્રકાશનની તારીખથી એકવીસ દિવસની અંદર સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (CRC), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (IICA), પ્લોટ નં. દ, ૭, ૮, સેક્ટર પ, IMT માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા) પિન કોડ - ૧૨૨૦૫૦ ખાતે રજિસ્ટ્રારને લેખિતમાં પોતાનો વાંધો જણાવી શકે છે. આ નોટિસ પ્રકાશિત થયાની તારીખથી એકવીસ દિવસની અંદર કંપનીને તેની રજિસ્ટર્ડ ઓફિસ ૧૭૧, સહાય્ય ઇન્ડ હબ, બકરોલ બુજરંગ, અમદાવાદ-૩૮૨૩૪૦, ગુજરાત, ભારત ખાતે એક નકલ મોકલી શકે છે.

તારીખઃ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫.

અરજદારોના ના સહી

૧. સુનીલકુમાર નરસિંહભાઈ પંચાલ

AMRAPALI INDUSTRIES LIMITED

Place: Ahmedabad

Regd. Office: - Unit No. PO5-02D, 5th Floor Tower A WTC Gift City Gandhinagar-382355. CIN: L91110GJ1988PLC010674 Phone: +7926581329/30 Fax: +91 79 26579169 E-mail: ail@amrapali.com Website: www.amrapalispot.com

STANDALONE

0.03

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2024

(Rs. in Lakh)

0.17

0.05

0.02

0.03

Nine Months Ended Year ended Nine Months Ended Quarter Ended **Quarter Ended PARTICULARS** 31/12/2024 30/09/2024 31/12/2023 31/12/2024 31/12/2023 31/03/2024 31/12/2024 30/09/2024 31/12/2023 31/12/2023 31/03/2024 (Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)| (Unaudited)| (Unaudited)| (Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Unaudited)|(Un Total Income from Operations 11,47,305.49 8,03,128.36 8,46,144.97 22,42,465.80 22,15,755.17 27,30,089.22 11,47,305.49 8,03,128.36 8,46,144.97 22,42,465.80 22,15,755.17 Net Profit / (Loss) for the period (before Tax, 26.41 21.12 79.32 26.57 79.47 103.07 Exceptional and/or Extraordinary items) 66.36 103.07 24.30 Net Profit / (Loss) for the period before tax (after 24.59 21.12 103.07 103.07 Exceptional and/or Extraordinary items) 26.41 79.32 66.36 26.57 24.30 21.12 79.47 66.36 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 27.49 10.43 16.30 63.87 64.86 89.66 27.65 10.14 16.30 64.02 64.86 89.66 Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) 64.86 89.66 27.65 64.86 2570.53 2570.53 2570.53 2570.53 **Equity Share Capital** 2570.53 2570.53 2570.53 2570.53 2570.53 2570.53 2570.53 2570.53 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)

0.13

Basic & Diluted:

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of the Quarter/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com and on company's website www.amrapalispot.com

0.12

For AMRAPALI INDUSTRIES LIMITED

0.13

0.17

0.12

YASHWANT AMRATLAL THAKKAR **MANAGING DIRECTOR** DIN:00071126

Place: AHMEDABAD Date: 12/02/2025